

તાત્કાલિક પ્રકાશન માટે

બ્રામ્પટનમાં યોજાયેલી 14-કલાકની હેકથોનમાં વિદ્યાર્થીઓની પ્રતિભા દીપી ઉઠી

આ આયોજન અઠવાડિક રજાઓ દરમિયાન બ્રામ્પટનમાં યોજાયેલા ટેકનોલોજી આધારિત ત્રણ પૈકી એક મેળાવડામાંનું એક હતું.

બ્રામ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 26, 2019) – 140 કરતા વધારે વિદ્યાર્થીઓ, શ્રેણીબદ્ધ નિષ્ણાતો, અને સમગ્ર GTA માંથી ડઝનબંધ ટેકનોલોજી ઉત્સાહીઓ રવિવાર, માર્ચ 24 નાં રોજ વોક્સ હેકથોનમાં સહભાગી થવા બ્રામલી સીટી સેન્ટરમાં ભેગા થયા હતા.

સીટી ઓફ બ્રામ્પટન અને ચિંગકુસી સેકન્ડરી સ્કૂલ દ્વારા આ સહિયારા આયોજનમાં, વાર્ષિક હેકથોનની બીજી આવૃત્તિમાં 14 કલાક સુધી હરીફાઈ કરતી ગ્રુપ્સ 8 થી 12 ની વિદ્યાર્થીઓની 30 ટીમો જોવા મળી. વિદ્યાર્થીઓએ સાઈબર સુરક્ષા, કળા, નકામા કચરાનું સંચાલન અને નવા આગંતુકો (ઈમિગ્રાન્ટ) માટે રોજગાર જેવા ક્ષેત્રોમાં નવીનતમ, ટેકનોલોજી આધારિત ઉકેલોની રચના અને પ્રદર્શન કર્યું. ઈનામો બેસ્ટ બિગિનર હેક અને શ્રેષ્ઠ સામાજિક/પર્યાવરણલક્ષી પ્રભાવ સહિતની, વિવિધ શ્રેણીઓમાં આપવામાં આવ્યા હતા.

ટોચનું ઈનામ ઈઝીપિલ (EasyPill), ચિત્તભ્રંશ (ડિમેન્શિયા)થી પીડાતા લોકોને મદદરૂપ થવા ડિઝાઈન કરેલા સાધનને મળ્યું. આ ગેજેટ વપરાશકારના સમયપત્રકને અનુરૂપ દવાની વહેંચણી સ્વચાલિત રીતે કરે છે, અને તેને મોબાઈલ ઍપનો ઉપયોગ કરીને સહેલાઈથી સંચાલિત કરી શકાય છે.

ઈનામના ભાગ તરીકે, ઈઝીપિલ ટીમને સપ્ટેમ્બર 13 થી 15, 2019 વચ્ચે, હેક ધી નોર્થ, કેનેડાની સૌથી વિશાળ હેકથોનમાં સ્પર્ધા કરવા નિમંત્રિત કરવામાં આવી છે. આ આયોજનનું યજમાનપદ યુનિવર્સિટી ઓફ વોટરલૂ સંભાળશે.

આપણાં શહેરમાં આ અઠવાડિક રજાઓમાં બે કોફી 'એન' કોડ આયોજનો પણ થયા, એક બ્રામ્પટન લાઈબ્રેરીની સિંગ્રંગડેલ શાખામાં, અને અન્ય પ્લેક્સિસ સોફ્ટવેરની ઓફિસમાં થયું હતું. કોફી 'એન' કોડ એ અવિધિસરની કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ મીટઅપ (અનૌપચારિક બેઠક) હતી જે શહેર દ્વારા બ્રામ્પટનમાં ટેક ઈકોસિસ્ટમ વિસ્તારવામાં સહાયતા કરવા યોજવામાં આવી.

બ્રામ્પટનના ટેકનોલોજી સમુદાયમાં સામેલ થવા ઈચ્છુક વ્યક્તિઓને આપણાં શહેરની સ્લેક ચેનલમાં જોડાવવા આવકારવામાં આવે છે, bramptoncity.slack.com.

અવતરણો (ક્વોટ્સ):

"હેકથોનની આ આવૃત્તિ એક આશ્ચર્યચકિત કરતી પહેલ હતી જેણે સમગ્ર GTA માંથી તેજસ્વી જુવાન તારલાઓને પ્રકાશિત કર્યા હતા. ઘણી સંસ્થાઓ આ આયોજનને સફળ બનાવવા સાથે આવી હતી. હું પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ, ચિંગકુસી સેકન્ડરી સ્કૂલ અને બ્રામલી સીટી સેન્ટરનો આપણી સાથે તેઓના સહયોગ બદલ આભાર માનું છું. આ શહેર બ્રામ્પટન અને તેની આસપાસના ધંધાકીય સાહસિકો અને નવી શોધ કરનારાઓને પ્રોત્સાહન આપવા ડિઝાઈન કરાતા આયોજનોને સગવડમય બનાવવા વિવિધ સંસ્થાઓ સાથે કામ કરવાનું ચાલુ રાખશે."

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

“હકેથોનનું આયોજન જુવાન, મહત્વાકાંક્ષી નવી શોધ કરનારાઓ માટે ભૂતપૂર્વ સીઅર્સ સ્ટોર્સમાં કરવું એ એક પ્રકારનો પ્રતિકાત્મક સંદેશો બન્યો હતો. વિદ્યાર્થીઓ સમાજે સામનો કરવો પડતો હોય તેવી સમસ્યાઓને સંબોધવા સહયોગ સાધીને ફ્લોર પર આવે ત્યારે સમગ્ર ફ્લોરને રચનાત્મક રોમાંચ સાથે જીવંત બનતું જોવું એ બહુ મોટી બક્ષિસ જેવું લાગતું હતું.”

- ડેવિન રામફાલ (*Devin Ramphal*), એકિંટંગ સીનિયર મેનેજર, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફિસ

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca